

AU SMALL FINANCE BANK LIMITED
INFORMATION NOTICE

The below mentioned Borrowers & Co-Borrowers are informed to remove their movable assets from the mortgaged property (mentioned in the below table) which has been sold by **AU Small Finance Bank Ltd. (A Scheduled Commercial Bank)** through auction proceeding under **SARFAESI Act, 2002**, otherwise the movable assets would be transferred to any rented location at their own cost and they will also be liable for any damage caused during the shifting, if it is not removed within 15 days. For other queries contact the concerning person as mentioned below.

Loan A/c No. / Name of Borrower/ Co-Borrower / Mortgagee/Guarantor	Detail of Mortgaged Property	Contact Person
(Loan A/C No.) L9001060123012761, Fine Handloom Gnuh Udhvyog (Borrower), Dhirubhai Vaniya S/O Mohanbhai (Co-Borrower), Smt. Gauriben Dhirubhai Vaniya (Co-Borrower)	Property Situated At - Survey Number 8, Plot Number: 10/C, Plot No. 10 Paiki, Vill & Tehsil - Limbdi, District - Surendranagar, Gujarat.	Zala Harvijay 8980020420
(Loan A/C No.) L9001070122145533, Parthbhai Mahendrabhai Vankar (Borrower), Smt. Kanchanben Vankar (Co-Borrower)	Property Situated At- Flat No. - O/202, 1st Floor, O Block, Galaxy Flats, Mouje- Chhatrai, Taluka- Kaloi, Dist- Gandhinagar, Gujarat.	Kintu Hasmukh Barot 8980058901

Date : 21/05/2026 Place : Gujarat Authorised Officer AU Small Finance Bank Limited

ELECTROTHERM (INDIA) LTD.
CIN : L29249GJ1986PLC009126
Registered Office: 502, Parshwa Tower, Opp. Tej Motors, Nr. Madhur Hotel, Sarkhej Gandhinagar Highway, Bodakdev, Ahmedabad-380054 Phone : +91-2717-660550
E-mail : sec@electrotherm.com, Website : www.electrotherm.com

STATEMENT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON 31ST MARCH, 2026

The Board of Directors of Electrotherm (India) Limited (the "Company") at their meeting held on 21st May, 2026, inter alia, considered and approved the Audited Standalone and Consolidated Financial Results of the Company for the quarter and year ended on **31st March, 2026**.

The full format of the same, alongwith the notes, are available on the website of stock exchanges at www.nseindia.com and www.bseindia.com and also available on the website of the Company at www.electrotherm.com. The same can also be accessed by scanning the QR code provided.

Place: Palodia
Date: 21st May, 2026

Note: The above intimation is in accordance with Regulation 33 read with Regulation 47(1) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

Registered Office: 27 BKC, C 27, G Block, Bandra Kurla Complex, Bandra (E), Mumbai - 400051. (Corporate Identity No. L65110MH1985PLC038137)
Regional Office: Kotak Mahindra Bank Ltd. 9th Floor, B-Wing, Vivaan Square, Jodhpur Cross Road, Satellite, Ahmedabad, Gujarat - 380015, Contact No. +91 9429919818, Email ID - punit.makhecha@kotak.com.

PUBLIC NOTICE FOR AUCTION CUM SALE

Notice is hereby given to the public in general and in particular to the **Borrower/Co-Borrower/Guarantor/Mortgagee** that the below described movable property mortgaged to Kotak Mahindra Bank Ltd. and the **Physical Possession** of which has been taken by the Authorised Officer of Kotak Mahindra Bank Ltd. against which expression of interest/offer has been received from an intended purchaser at the amount mentioned as Reserve Price and therefore further offers are invited by the undersigned in sealed covers for purchase of immovable property described herein under will be sold on **"AS IS WHERE IS"** and **"AS IS WHAT IS"** basis. Offers are invited to take part in e-auction through the Web Portal of our e-Auction Service Partner, **M/s.C1 India Pvt Ltd (www.c1india.com)** i.e. <https://www.bankauctions.com> by the undersigned for sale of the immovable property of which particulars are given below:-

Name of the Borrower(s) / Guarantor(s) / Mortgagee(s)	Demand Notice Date and Amount	Description of the Immovable properties	Reserve Price	Earnest Money Deposit (EMD)	Date / Time of e-Auction
1. Kishanram P Choudhary (Borrower), 2. Rameshbhai P Choudhary (Co-Borrower), 3. Champadevi Kishanram (Co-Borrower), 4. Arjun P Choudhary (Co-Borrower) (Loan Account No.) RHB333379	Dt. 29.06.2024 Rs. 59,25,172.81/- (Fifty Nine Lakh Twenty Five Thousand One Hundred Seventy Two and Eighty One Paisa)	Plot No. 85, Apple Pool Villa, Block No. 206, Kadodara, Bardoli Road, Surat	Rs. 49,66,448/- (Rupees Forty Nine Lakh Sixty Six Thousand Four Hundred Forty Eight Only)	10% of Bid Amount Rs. 4,96,644.8/- (Rupees Four Lakh Ninety Six Thousand Six Hundred Forty Four and Eight Paisa Only)	12.06.2026, Time - 11.00 A.M. to 12.00 P.M.

Date of Inspection of Immovable Properties : 02.06.2026 Time 11.00 A.M. 01. 00 P.M. **Last Date for Submission of Offers / EMD : 10.06.2026 till 4.00 P.M.**

IMPORTANT TERMS & CONDITIONS OF SALE:-

- The Auction is conducted as per the further Terms and Conditions of the Bid document and as per the procedure set out therein. Bidders may go through the website of our E-Auction Service Provider, M/s. C1 India Pvt. Ltd. i.e. <https://www.bankauctions.com> for bid documents, the details of the secured asset put up for e-Auction and the Bid Form which will be submitted online;
- All the intending purchasers/ bidders are required to register their name in the Web Portal mentioned above as <https://www.bankauctions.com> and generate their User ID and Password in free of cost of their own to participate in the e-Auction on the date and time aforesaid;
- For any enquiry, information, support, procedure and online training on e-Auction, the prospective bidders may contact the M/s. C1 India Pvt. Ltd. Department of our e-Auction Service Partner **P. Dharti Krishna**, through csd@disposahub.com Tel. No. : +91 7291971124, 25, 26, Mobile No. : 99481 82222 & E-mail ID: andhra@c1india.com & support@bankauctions.com;
- The best of knowledge and information of the Authorised officer, there is no encumbrance in the property/ies. However, the intending bidders may inspect the property and its documents as mentioned above on any other date 5 time with prior appointment and they should make their own independent inquiries regarding the encumbrance, title of property/ies put on e-Auction and claims/ right/ dues/ affecting the property prior to submitting their bid. The e-Auction advertisement does not constitute any commitment or any representation of KMBL. The property is being sold with all the existing and future encumbrances whether known or unknown to KMBL. The Authorised Officer/ Secured Creditor shall not be responsible in any way for any third party claims/ rights/ dues;
- For participating in the e-Auction, intending purchasers/ bidders will have to submit/upload in the Web Portal (<https://www.bankauctions.com>) the details of payment of interest-free refundable Earnest Money Deposit (EMD) of the secured asset as mentioned above by way of **Demand Draft** in favour of **Kotak Mahindra Bank Limited** payable at **Rajkot** along with self-attested copies of the PAN Card, Aadhaar Card, Residence Address Proof, Board Resolutions in case of company and Address Proof as specified above. The Borrower(s) / Mortgagee(s) / Guarantor(s) are hereby given **STATUTORY 30 DAYS NOTICE UNDER RULE 6(2), 8(6) & 9(1) OF THE SARFAESI ACT** to discharge the liability in full and pay the dues as mentioned above along with upto date interest and expenses with in 15/30 days from the date of this notice failing which the Secured Asset will be sold as per the terms and conditions mentioned above. In case there is any discrepancy between the publications of sale notice in English and Vernacular newspaper, then in such case the English newspaper will supersede the vernacular newspaper and it shall be considered as the final copy, thus removing the ambiguity. If the borrower/guarantors/mortgagees pays the amount due to Bank, in full before the date of sale, auction is liable to be stopped.

For detailed terms and conditions of the sale, kindly visit our official website <https://www.kotak.com/en/bank-auctions.html> or contact the Authorised Officer **Mr. Prashant Satpute** on **9724433999** / **Mr. Ashok Motwani** on **9747373735** at above mentioned Regional Office of Bank.

Special Instruction : e-Auction shall be conducted by our Service Provider, M/s. C1 India Pvt. Ltd. on behalf of Kotak Mahindra Bank Limited (KMBL), on pre-specified date, while the bidders shall be quoting from their own home/ office/ places of their Bid as per their choice above the Reserve Price. Internet connectivity and other paraphernalia requirements shall have to be ensured by bidders themselves. Please note that failure of Internet connectivity (due to any reason whatsoever it may be) shall be sole responsibility of bidders and neither KMBL nor C1 India Pvt. Ltd. shall be responsible for these unforeseen circumstances. In order to ward-off such contingent situation, bidders are requested to make all the necessary arrangements/ alternatives whatever required so that they are able to circumvent such situation and still be able to participate in the e-Auction successfully. However, it is requested to the Bidders(s) not to wait till the last moment to quote/improve his/her Bid to avoid any such complex situations.

Date : 22.05.2026, Place : Surat

Sd/-
Authorised Officer, Kotak Mahindra Bank Ltd.

AXIS BANK
Branch Office : Axis Bank Limited, Collection Center, First Floor, Unit No.101 & 102 (Part) Baileshwar Avenue S G Highway Opp. Rapath Club Bodakdev Ahmedabad Gujarat - 380 054. **Corporate Office :** Axis Bank Ltd., 3rd Floor, Gigaplex, NPC - 1, TTC Industrial Area, Mugalsan Road, Airoli, Navi Mumbai - 400708.

Demand Notice

We, Axis Bank Ltd. (formerly known as UTI Bank Ltd.) (hereinafter referred to as "the Bank") having its Registered Office at Trishul, Opp. Samarbhav Temple, Law Garden, Ellisbridge, Ahmedabad - 380006 among other places Axis Bank Ltd., 1st Floor, Baileshwar Avenue, S G Highway, Opp. Rapath Club, Bodakdev, Ahmedabad, Gujarat - 380054 and do hereby give the notice under Section 13(2) of the aforesaid Act in its capacity as Secured Creditor, Whereas the Borrowers / Guarantors / Mortgagees mentioned hereunder had availed the financial assistance from Axis Bank Ltd. We state that despite having availed the financial assistance, the Borrowers / Guarantors / Mortgagees have committed defaults in repayment of interest and principal amounts as per due dates. The Account have been classified as Non-Performing Asset on the date mentioned hereunder in accordance with the directives / Guidelines issued by Reserve Bank of India. Consequently the Authorised Officer of Axis Bank Ltd. under Securitisation & Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 in exercise of powers conferred under Section 13(2) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued demand notice to borrowers / Co - Borrowers / Guarantors / Mortgagees on the dates mentioned herein below under section 13(2) of Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 to pay the amount mentioned in the said notice together with further interest at the contractual rate, costs, charges and incidental expenses etc. however the notices were returned service and as such they are hereby informed by way of public notice about the same.

Sl. No	Name of the Borrower/Co-Borrower/ Guarantor and Address / Loan Account Number	Demand Notice & NPA Date	Outstanding Amount (Rs.) as per 13(2) Notice	Description of the Mortgaged Property / Security Assets
1	(1) MR. HITESHBHAI GAUTAMBHAI PATEL (Borrower), 21, NEAR GANESH TEMPLE, SURYAKRUPA DREAM RANGAIPURA, PETLAD, ANAND, GUJARAT - 388450. (2) MRS. PATEL SEJALBEN HITESHBHAI (Co-Borrower), 21, NEAR GANESH TEMPLE, SURYAKRUPA DREAM RANGAIPURA, PETLAD, ANAND, GUJARAT - 388450. Also at - TRUPTI SOCIETY, JITOODIA (PART), ANAND, JITOODIA, GUJARAT - 388001.	14-05-2026 & 09-07-2025	Rs. 14,30,072/- & 19,55,085.98/- as on 14-05-2026	ALL THAT PIECES AND PARCELS OF JAT REGISTRATION DISTRICT ANAND AND SUB-DISTRICT AND TALUKA PETLAD, MOJE VILLAGE RANGAIPURA, REVENUE BLOCK NO-4177/PAIKI SQ.M. 11828 (HA.1-18-28) OF THE PLOTS ALLOTTED IN THE LAND ELIGIBLE FOR NON-CULTIVATION FOR RESIDENTIAL PURPOSES. (1) PLOT NO.21 IS OPEN LAND, ITS TOTAL SQ.M IS 108.73, ITS SQ.FT. IS 11720.00. (2) PLOT NO. 28 IS AN OPEN LAND, THE TOTAL AREA OF WHICH IS 108.73 SQ.M. AND THE AREA OF WHICH IS 11720.00 SQ.FT. AS UNDER: PLOT NO. 21 BOUNDARIES: EAST : SOCIETY ROAD, WEST : PLOT NO. 28, NORTH : PLOT NO. 22, SOUTH : SOCIETY ROAD. PLOT NO. 28 BOUNDARIES : EAST : PLOT NO. 21, WEST : SOCIETY ROAD, NORTH : PLOT NO. 27, SOUTH : SOCIETY ROAD.
2	1) MR. ANKITKUMAR VALAND (APPLICANT), 3-68 THANDRIPAL, KATHAPUR, JAGTAL, KARIMNAGAR, TELANGANA - 505006. 2) MRS. SUMITRABEN VALAND (CO-APPLICANT), AZAD CHOK, VADODRA, KANUVA, VADODRA, ANAND, PETLAD, GUJARAT, 388430.	14-05-2026 & 09-07-2025	Rs. 16,48,691.21/- as on 14-05-2026	ALL THAT PIECE AND PARCEL OF IMMOVABLE PROPERTY BEARING RESIDENTIAL FLAT NO. 211, HAVING SUPER BUILT UP AREA ADMEASURING 36.00 SQ. MTRS. ON SECOND FLOOR TOGETHER WITH UNDIVIDED PROPORTIONATE SHARE ADMEASURING 10.00 SQ.MTRS. IN THE SCHEME KNOWN AS "RADHE COMPLEX 1" CONSTRUCTED ON NON-AGRICULTURAL LAND BEARING OF FINAL PLOT NO. 8, 45 PAIKI OF TOWN PLANNING SCHEME NO. 2 OF REVENUE SURVEY NO. 330/5, 330/6; SITUATED, LYING AND BEING AT MOUJE, PETLAD IN THE REGISTRATION DISTRICT ANAND AND SUB-REGISTRATION DISTRICT PETLAD WITHIN THE STATE OF GUJARAT, WHICH IS IN THE NAME OF MR. ANKITKUMAR VALAND. BOUNDARIES: EAST - MARGIN LAND AFTER FINAL PLOT NO. 44/2, WEST - MAIN ENTRY OF THE SAID FLAT AND PASSAGE, NORTH: FLAT NO.210 ON 2ND FLOOR WITH ADJOINING WALL, SOUTH: FLAT NO.212 ON 2ND FLOOR.
3	(1) MR. CHITRODA VISHAL KUMAR (APPLICANT), BLOCK 12, HOUSE NUMBER 116, MARUTHIMHAR, GUJARAT HOUSING BOARD NEAR GIDC ROAD, MAKARPURA, VADODARA, GUJARAT, INDIA - 390010. (2) MRS. MISTRY PRAVINBHAI (CO-APPLICANT), 12/116, MARUTI DHAM SOCIETY, NEAR GIDC ROAD, MAKARPURA, VADODARA, GUJARAT, INDIA - 390010.	14-05-2026 & 28-10-2025	Rs. 20,26,725/- as on 14-05-2026	ALL THAT PIECE AND PARCEL OF PROPERTY OF MOJE VILLAGE TARSALI OF REG. DISTRICT AND REG. SUB-DISTRICT VADODARA DIVISION 2, F. PLOT NO. 42 OF DRAFT TP SCHEME NO. 38 (TARSALI), IN THE LAND MEASURING 4910.00 SQ.M. (PLOT-B) AS PER THE NECESSARY PERMISSIONS OBTAINED THROUGH THE APARTMENT SYSTEM. A PROJECT NAMED "PUSHKAR SKYLINE" HAS BEEN PLANNED ON THE SOUTH SIDE OF THE ENTIRE UNCULTIVATED LAND OF BLOCK/SURVEY NO. 63, FLAT NO. E-703 ON THE SEVENTH FLOOR IN TOWER, HAVING A CONSTRUCTION AREA OF 72.67 SQ.M. INCLUDING CARPET AND BALCONY AND WASH AREA OF 3.54 SQ.M. AND AN OPEN TERRACE/TERRACE ADJOINING THE SAID FLAT MEASURING 82.83 SQ.M. AND AN AREA OF UNDIVIDED LAND ADJOINING THE SAID FLAT MEASURING 29.51 SQ.M. WHICH IS IN THE NAME OF MR. CHITRODA VISHAL KUMAR. BOUNDARIES : EAST : FLAT NO. E-702 IS LOCATED, WEST : FINAL PLOT NO. 38 IS LOCATED, NORTH: THERE IS AN OPEN BALCONY/TERRACE, SOUTH: FINAL PLOT NO. 42 IS LOCATED.
4	(1) MR. AVINASH MANHARIL KACHHELA (APPLICANT) A-101, SHANTINAGAR APP. GULI TOWER IN SAME, ADARN ROAD, SURAT, GUJARAT, INDIA 395009. (2) MRS. NETAIBEN AVINASH KACHHELA (CO-APPLICANT) A-101, SHANTINAGAR APP. GULI TOWER IN SAME, ADARN ROAD, SURAT, GUJARAT, INDIA 395009.	14-05-2026 & 09-12-2025	Rs. 8,21,867/- as on 12-05-2026	ALL THAT PIECE AND PARCEL OF MOJE VILLAGE ADARN, SURAT DISTRICT CITY SUB-DISTRICT: R.S. NO. 335/1 UNCULTIVATED LAND TO WHICH TP SCHEME NO. 13 APPLIES, OUT OF THE PLOTS ALLOTTED ON THE LAND BEARING FINAL PLOT NO. 205, A PLANNED HOUSE WAS BUILT ON THE LAND BEARING PLOT NO. B MEASURING 721.40 SQ.M. KEDARNATH CO. O.H. SOCIETY LIMITED AMONG THE RESIDENTIAL FLATS IN BUILDING B CONSTRUCTED BY A REGISTERED SOCIETY. FLAT NO. B/403 HAVING AN AREA OF ABOUT 661 SQ. FT. I.E. 61.41 SQ. M. WHICH IS IN THE NAME OF MR. AVINASH MANHARIL KACHHELA AND MRS. NETAIBEN AVINASH KACHHELA. BOUNDARIES : EAST : APPLICABLE FLAT NO. B/404, WEST : APPLICABLE FLAT NO. B/402, NORTH: APPLICABLE SOCIETY ROAD, SOUTH: APPLICABLE TIKTHARJI BUILDING.
5	1) MR. DINESHBHAI BHIKHABHAI MENDAPARA (APPLICANT), 55-SHAWAR, NAGAR-2, PUNA-87, SURAT, GUJARAT, INDIA - 394210. (2) MRS. MANJULABEN D. MENDAPARA (CO-APPLICANT), 55 - ISHWAR NAGAR-2, PUNA-87, SURAT, GUJARAT, INDIA - 394210.	14-05-2026 & 10-03-2026	Rs. 8,84,801/- as on 12-05-2026	ALL THAT PIECE AND PARCEL OF THE LAND AND BUILDING BEARING OF SHOP NO. 2012 CARPET AREA ADMEASURING ABOUT 281.38 SQ. FTS. EQUIVALENT TO 26.17 SQ. MTRS. ON 2ND FLOOR TOGETHER WITH UNDIVIDED PROPORTIONATE SHARE IN UNDERWATER LAND OF "RAJANAH NALL" CONSTRUCTED ON LAND BEARING REVENUE SURVEY NO. 118, BLOCK NO. 190/PAN-2, I. F. SCHEME NO. 69 IGODADARA DINDOLI, FINAL PLOT NO. 151 ADMEASURING ABOUT 19351.00 SQ. MTRS. OF VILLAGE: DINDOLI, SUB: DISTRICT: CITY, DISTRICT: SURAT, WHICH IS IN THE NAME OF MRS. MANJULABEN D. MENDAPARA. BOUNDARIES: EAST: ADJ. ROAD, WEST: I. F. NO. 150, NORTH: I. F. NO. 152/B AND ROAD, SOUTH: I. F. NO. 68/B AND I. F. NO. 158.

Please further notice that as mentioned in sub - section 13 of Sec. 13 of the aforesaid Act, you shall not transfer by way of sale, lease or otherwise any of the assets stated under security referred to in this Notice without prior written consent of our Bank.

DATE - 22.05.2026, PLACE - Gujarat

Sd/-, Authorized Officer, Axis Bank Ltd.

VINNY OVERSEAS LIMITED
CIN: L51909GJ1992PLC017742
B/H INTERNATIONAL HOTEL, NAROL-ISANPUR ROAD NAROL, AHMEDABAD - 382405 GUJARAT | Website: www.vinnyoverseas.in

AUDITED FINANCIAL RESULTS FOR THE 4TH QUARTER AND YEAR ENDED MARCH 31, 2026

The Audited Financial Results of Vinny Overseas Limited ("the Company") along with the Audit Report of the Statutory Auditors of the Company for the quarter and Year ended March 31, 2026 have been reviewed by the Audit Committee and approved by Board of Directors of the Company at their Meeting held on May 20, 2026, in terms of Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

The aforementioned financial results along with the Audit Report of the Statutory Auditors thereon are available on the website of BSE (www.bseindia.com) and NSE (www.nseindia.com) and on the Company's website at <https://www.vinnyoverseas.in/>. The same can also be accessed by scanning the QR Code provided below:

For and on behalf of the Board of Directors
Vinny Overseas Limited
Sd/-
Hiralal Jagdishchand Parekh
Managing Director
(DIN: 00257758)

Date : 20/05/2026
Place: Ahmedabad

AEGIS LOGISTICS LIMITED
CIN: L51909GJ1992PLC017742
Regd. Office: 502 Skylin, G.I.D.C. Chir Rosty, Wap 396 195, Dist. Valod, Gujarat
Corp. Office : 1202, Tower B, Panisolu Business Park, G. K. Marg, Lower Parel (W), Mumbai - 400013 Tel. : +91 22 6666 3666 Fax : +91 22 6666 3777
E-mail : aegis@aegisindia.com Website : www.aegisindia.com

NOTICE is hereby given that the following Share Certificate(s) for Equity Share(s) of face value of Re.1/- each has been lost or misplaced and the below named registered shareholder(s) / legal heir(s) has/have applied to the Company to issue duplicate Certificate(s) for the said shares. Any person who has a claim in respect of the said shares should lodge such claim with the Company at its Corporate Office within fifteen days from this date else the Company will proceed to issue duplicate Certificate(s).

Folio No.	Name of Shareholder	Certificate No.	Distinctive Nos. From To	Shares
A03481	Asha Mittal	430	649231 655890	6660

For Aegis Logistics Limited
Sd/-
Company Secretary

Place : Mumbai
Date : 21/05/2026

UGRO Capital Limited
B-77, Fourth Floor, Art Lullu House, Phoenix Market City, Kurla (West), Mumbai - 400050

DEMAND NOTICE

UNDER THE PROVISIONS OF THE SECURITIZATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002 ("THE ACT") AND THE SECURITY INTEREST (ENFORCEMENT) RULES, 2002 ("THE RULES")

The undersigned being the authorized officer of UGRO Capital Limited under the Act and in exercise of the powers conferred under Section 13(2) of the Act, read with the Rule 3, issued Demand Notice(s) under Section 13(2) of the Act, calling upon the following borrower(s) to repay the amount mentioned in the respective notices within 60 days from the date of receipt of the said notice. The undersigned reasonably believes that the borrower(s) are avoiding the service of the demand notice(s), therefore the service of the demand notice(s) is being effected by affixation and publication as per the Rules. The contents of the demand notice(s) are extracted herein below.

Name of the Borrower(s)	Demand Notice Date and Amount
1) MEERA & CO 2) AJIJBHAI ADAMBHAI MEPANI 3) ABAS MEPANI 4) RUKSHANA ABBASBHAI MEPANI LAN - HCFJAMSEC0001018547	Demand Notice date : 13-May-2026 Notice Amount : Rs. 47,73,129.00/- (Rupees Forty Seven Lakh Seventy Three Thousand One Hundred Twenty Nine and Nil Only) As on 11/05/2026

Description of Secured Asset(s) - Item 1 - All that rights, title & interest in Residential Property bearing Survey No. 01 Paiki, Sheet No.16, City Survey No.1005, Land Admeasuring ground area 185.66 Sq.Mtrs, on the Land of Sikka Nagar, at sikka, taluka & district Jamnagar and Registration Sub district of Jamnagar within the state of Gujarat. Batted and bounded on the East by Land of Revenue Survey No.82, on the West by Open Land, on the North by open Land and Read and on the South by Main Road.

Item 2 - All that rights, title & interest in Residential Property bearing being a Plot No.14, Land admeasuring around area 554.28 Sq.Mtrs on the Land of R.S. No.396 At Bharuwa, Taluka Khambhaliya & District Devbhoomi Dwarika, and Registration Sub-District of Khambhaliya within the State of Gujarat. Batted and bounded on the East Land of Revenue Survey No.398, on the West by Land of Revenue Survey No.295, on the North by Land of Plot No.15, on the South by Land of Revenue Survey No.398.

Item 3 - All that rights, title & interest in Residential Property bearing "Plot No.11 and 12", Land admeasuring around area 626.65 Sq. Mtrs on the Land of R.S. No.218, at Sikka, Taluka and District Jamnagar, and Registration Sub district of Jamnagar within the state of Gujarat. Batted and bounded on the East by Road, on the West by Survey No.1/1, on the North by Land of Plot No.9 and 10, on the South by Road.

The borrower(s) are hereby advised to comply with the demand notice(s) and pay the demand amount mentioned therein and thereupon within 60 days from the date of this publication together with applicable interest, late payment penalty, bounce charges, cost and expenses etc. till the date of realization of the payment. The borrower(s) may note that UGRO Capital Limited is a Secured Creditor and the loan facility availed by the borrower(s) is a secured debt against the immovable property(ies) being the secured assets mortgaged by the borrower(s) with UGRO Capital Limited. In the event, the borrower(s) are failed to discharge their liabilities in full within the stipulated time, UGRO Capital Limited shall be entitled to exercise all the rights under Section 13(4) of the Act to take possession of the Secured Asset(s) including but not limited to transfer the same by way of sale or by knocking any other remedy available under the Act and the Rules thereunder in order to realize the dues in the due account of the borrower(s). UGRO Capital Limited is also empowered to AT&F AND/OR S&F, the Secured Asset(s) before enforcing the right to sale or transfer. Subsequent to the sale of the Secured Asset(s), UGRO Capital Limited also has a right to initiate separate legal proceedings to recover the balance dues, in case the value of the Secured Asset(s) is insufficient to cover the dues payable by the borrower(s) to UGRO Capital Limited. The remedy is in addition and independent of all other remedies available to UGRO Capital Limited under any other law.

The attention of the borrower(s) is invited to Section 13(8) of the Act in respect of time available to redeem the Secured Asset(s) and further to Section 13(13) of the Act, whereby the borrower(s) are restricted/prohibited from disposing or dealing with the Secured Asset(s), or transferring the same by way of sale lease or otherwise (other than in ordinary course of business) any of the Secured Asset(s) without prior written consent from UGRO Capital Limited and non-compliance of the above is an offence punishable under Section 29 of the Act. The copy of the demand notice(s) is available with the undersigned and the borrower(s) may, if they so desire, collect the same from the undersigned.

Date: 22.05.2026, Place: GUJARAT **Sd/- (Authorised Officer), UGRO Capital Limited**

CROP LIFE SCIENCE LIMITED
CIN : L24124GJ2006PLC048297
Registered Address: 6th Floor, ABS Tower, Near Chakli Circle, O.P. Road, Vadodara, Gujarat, India, 390007 | Ph: 0265-2637210
Email ID: cs@croplifescience.com | Website: www.croplifescience.com

NOTICE OF POSTAL BALLOT & E-VOTING INFORMATION

Notice is hereby given pursuant to the provisions of Sections 108 and 110, and other applicable provisions of the Companies Act, 2013, as amended ("the Act"), read together with the Companies (Management and Administration) Rules, 2014, as amended ("the Management Rules"), General Circular No. 03/2025 dated September 22, 2025, 09/2024 dated September 19, 2024, 17/2020 dated April 13, 2020 and 14/2020 dated April 08, 2020 issued by the Ministry of Corporate Affairs, Government of India (hereinafter collectively referred to as the "MCA Circulars"), Secretarial Standards on General Meetings issued by the Institute of Company Secretaries of India ("SS-2") and any other applicable laws, rules, circulars, notifications and regulations (including any statutory modification(s) or re-enactment(s) thereof, for the time being in force), approval of members of the Company is sought for the following special resolutions as set out in the notice of Postal Ballot by voting through electronic means only ("remote E-Voting").

Sl. No.	Description of Resolution
1.	Regularisation of Appointment of Ms. Sheetalben Rachit Shah (DIN: 11633798) as a Non-Executive Independent Director of the Company

The Company has sent Postal Ballot Notice along with the Explanatory Statement on May 21, 2026, by email to only those members who have registered their email addresses with the Company/ RTA/ depository/ depository participants and whose names appear in the Register of Members of the Company or in the Register of Beneficial Owners maintained by the Depositories as on Friday, May 15, 2026.

Members may note that the Notice is also available on Company's website at www.croplifescience.com, website of NSE at www.nseindia.com and website of CDSL at www.evotingindia.com.

The physical copy of the Notice along with explanatory statement, Postal Ballot Form and pre-paid business reply envelope (BRE) has not been sent for this postal ballot in due compliance of MCA circulars.

The Remote e-voting period shall commence on Tuesday, May 26, 2026 (9:00 A.M. IST) and end on Wednesday, June 24, 2026 (5:00 P.M. IST) (both days inclusive). During this period shareholders of the Company, holding shares either in physical form or in dematerialized form, as on the cut-off date i.e. Friday, May 15, 2026 may cast their vote electronically. The e-voting module shall be disabled by CDSL for voting thereafter.

Members are requested to refer to the detailed instructions for E-voting mentioned in notes forming part of the Postal Ballot Notice.

All grievances connected with the facility for voting by electronic means may be addressed to Mr. Rakesh Dahi, Sr. Manager, (CDSL), Central Depository Services (India) Limited, A Wing, 2nd Floor, Marathon Futurex, Mafatlal Mill Compounds, N.M. Joshi Marg, Lower Parel (East), Mumbai - 400013 or send an email to helpdesk@cdslindia.com or call at toll free no. 1800 21 09911.

Mr. Ranjit Kumar Singh, Practicing Company Secretary, Vadodara is appointed as the Scrutinizer for conducting the Postal Ballot through remote e-voting process in a fair and transparent manner.

The result of the Postal Ballot shall be declared by the Chairman or any other duly authorized person of the Company on or before Friday, June 26, 2026, the same shall be communicated to the Stock Exchange and would also be uploaded on the Company's website at www.croplifescience.com.

Members who have not registered their e-mail address so far, or want to change their email IDs, are requested to register/change the same with the Company/ RTA/ their Depository Participants, so as to receive all communications electronically.

By order of the Board
For, Crop Life Science Limited
Sd/-
Rajeshkumar Vrajil Nagaraiya
Managing Director
DIN: 01580748

Date: 21.05.2026
Place: Vadodara

DEBTS RECOVERY TRIBUNAL-1
Govt. of India, Ministry of Finance, Department of Financial Services
4th Floor, Bhikhabhai Chambers, 18, Gandhinagar Society, Nr. Kochrab Ashram, Ellisbridge, Ahmedabad-380 006
(Established u/s. 3 of the Recovery of Debts due to Banks & Financial Institutions Act, 1993, for the area comprising Districts of Ahmedabad, Gandhinagar, Mehsana, Patan, Sabarkantha (Himmatnagar), Banaskantha (Palanpur) of Gujarat State w.e.f. 1st June, 2007)

(See Section 25 to 29 of the Recovery of Debts and Bankruptcy Act, 1993 read with Rule 2 of Second Schedule of the Income Tax Act-1961)

R.C. NO. 03/2026	O.A. NO. 117/2018
Indian Overseas Bank	Certificate Holder
VIS.	Certificate Debtor
Yogiraj Hanumanthbhai Khire & Ors.	

DEMAND NOTICE

To,

CD No.1 Mr. Yogiraj Hanumanthbhai Khire, residing at Flat no. A-101, "Devkrupa-Crystal", Hathijan Circle, S.P. Ring Road, Vinzol, Ahmedabad-380011.

CD No.2 Mr. Hanumanthbhai Khire, (Since deceased through his legal representatives)
 2(a) Mr. Yogiraj Hanumanthbhai Khire (Son of deceased Defendant no.2)
 2(b) Mrs. Supriya Hanumanthbhai Khire (Wife of deceased Defendant no.2)
 2(c) Mrs. Snehal Hanumanthbhai Khire (Daughter of deceased Defendant no.2)
 All residing at Flat no. A-101, "Devkrupa-Crystal", Hathijan Circle, S.P. Ring Road, Vinzol, Ahmedabad-380011.

In view of the Recovery Certificate issued in T.A./O.A./M.A./Misc. I.A. No. 117/2018 passed by the Hon'ble Presiding Officer, DRT-I, Ahmedabad an amount Rs. 22,97,467.07/- (Rupees Twenty Two Lakhs Ninety Seven Thousand Four Hundred Sixty Seven and Paise Seven Only) is due against you.

You are hereby called upon to deposit the above/below sum within 15 days of the receipt of the notice, failing which the recovery shall be made as per rules.

In addition to the sum aforesaid you will be liable to pay:

- Such interest & Cost as is payable in terms of Recovery Certificate.
- All costs, charges and expenses incurred in respect of the service of this notice and other process that may be taken for recovering the amount due.

Sd/-
Given under my hand and the seal of the Tribunal,
this 28th Day of April, 2026.
Next Date : 28.07.2026

(Love Kumar)



વિન્ની ઓવરસીઝ લીમટેડ

CIN:L51909GJ1992PLC017742

ઈન્ટરનેશનલ હોટેલ પાછળ, નારોલ-ઇસનપુર રોડ, નારોલ, અમદાવાદ -૩૮૨૪૦૫, ગુજરાત

વેબસાઈટ: www.vinnyoverseas.in

૩૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ પુરા થતાં ચોથા ત્રિમાસિક અને વર્ષના ઓડિટેડ નાણાંકિય પરિણામો

વિન્ની ઓવરસીઝ લીમીટેડ (કંપની) ના ૩૧ માર્ચ, ૨૦૨૬ના રોજ પુરા થતાં ત્રિમાસિક અને વાર્ષિક અનઓડિટેડ નાણાંકિય પરિણામો તેમજ કંપનીના સ્ટેચ્યુટરી ઓડિટર્સ ઓડિટ રીપોર્ટની સેબી (લિસ્ટેડ ઓબ્લીગેશન્સ અને ડિસ્ક્લોઝર ટીકવાયરમેન્ટ્સ) નિયમનો, ૨૦૧૫ ના નિયમન ૩૩ અનુસાર ઓડિટ કમીટી દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી અને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ૨૦ મે, ૨૦૨૬ ના રોજ ચોજાયેલ તેમની બેઠકમાં મંજૂર કર્યાં હતાં.

ઉપરોક્ત નાણાંકિય પરિણામો તેમજ તેના પરનો સ્ટેચ્યુટરી ઓડિટર્સનો ઓડિટ રીપોર્ટ બીએસઇની વેબસાઈટ (www.bseindia.com) અને એનએસઈની વેબસાઈટ (www.nseindia.com) અને કંપનીની વેબસાઈટ <https://www.vinnyoverseas.in/> ઉપર પણ ઉપલબ્ધ છે. તે આપેલ ક્યુઆર કોડ સ્કેન કરીને પણ મેળવી શકાશે.

સ્થળ: અમદાવાદ
તારીખ: ૨૦/૦૫/૨૦૨૬



બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ વતી અને માટે વિન્ની ઓવરસીઝ લીમીટેડ વતી સહી/-
હિસાલબ જગદિશચંદ્ર પારેખ
મેનેજિંગ ડાયરેક્ટર
(ડીઆઈએન: ૦૦૨૫૭૭૫૮)



બંજાર હાઉસિંગ ફાયનાન્સ લીમીટેડ

કોર્પોરેટ ઓફીસ : લેડીબંધ આઈડી પાર્ક બી-૨ બિલ્ડિંગ, પાંચમો માળ, કલ્યાણી નગર, પુણે, મહારાષ્ટ્ર-૪૧૧૦૧૪
શાખા ઓફીસ : ગીરે મેઘ, ગોંડલ રોડ, ઉલોગનનગર કોલેબી, ભદિત નગર, રાજકોટ, ગુજરાત-૩૬૦૦૦૨
નામ : કુનાલ શાહ, ઇમેઇલ આઇડી : Kunal.shah@bajajhousingfin.in મો. નં. : ૯૪૦૮૯૪૪૪૪ અને ૯૫૮૬૦૦૬૪૦૬

પરિશિષ્ટ ૪-એ (નિયમ ૮(૬)) સ્થાવર મિલકતોના વેચાણ માટે વેચાણ નોટીસ

સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮(૬) ની જોગવાઈઓ સાથે વંચતા સિક્યોરીટીઈજેશન અને સેકન્ડરેકશન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ સ્થાવર મિલકતોના વેચાણ માટે ઈ-દરાજી વેચાણ નોટીસ આપી પાસ કરીને દેવાદાર(સ) અને જામીનદાર(સ) અને જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે નીચે દર્શાવેલ સ્થાવર મિલકતો સિક્યોર્ડ લેણદારને ગીરો/ચાર્જ કરાયેલ છે, જેનો ભૌતિક કબજો બંજાર હાઉસિંગ ફાયનાન્સ લીમીટેડ (સિક્યોર્ડ લેણદાર) ના અધિકૃત અધિકારીએ લઈ લીધો છે, “જે જ્યાં છે”, “જે છે” અને “જેમ છે” ના ઘોરણે નીચે આપેલ વિગતો મુજબ લોનની બાકી રકમ, લાગુ વ્યાજ, ચાર્જિસ અને કોસ્ટ વગેરેની વસુલાત માટે વેચવામાં આવશે.

લોન એકાઉન્ટ નંબર અને દેવાદાર(સે)/ જામીનદાર(સે) નું નામ અને સરનામું	સ્થાવર મિલકતોની વિગતો	ઈ-દરાજીની વિગતો
લોન નં. M416HMLD0530216, M416HMLT0543765 & M416HMLT0543766	રાજકોટ સિટી રેવન્યુ સર્વે નં. ૨૬૬ પેકી ટીપી સ્કીમ નં. ૫, એફપી નં. ૪૩, ૪૪ અને ૪૭, પ્લોટ નં. ૧ થી ૪ અને ૫ થી ૮, કુલ જમીન ક્ષેત્રફળ ૯૪૫-૧૬ ચો.મી., શિવાલય બંગલોઝ સે હાઉસ પેકી સળ પ્લોટ નં. ૧ થી ૪/૪ જમીન ક્ષેત્રફળ ૯૦-૫૫૮ ચો.મી., બ્લોક નં. ૭, સિટી સર્વે નં. ૧૦/૨, સિટી સર્વે નં. ૨૮૮૫/કે/૩૫/૪, ખાતેની રેસિડેન્સીયલ હાઉસની મિલકતના તમામ ભાગ અને	ઈ-દરાજીની તારીખ: ૦૬/૦૬/૨૦૨૬ સવારે ૧૧:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમિયાન પ મિનિટના અમચર્ચિત લંબણ સહીત (૨) ઇમેઇડી તેમજ કેવાલસી જમા કરવાની છેલ્લી તારીખ: ૦૮/૦૬/૨૦૨૬ ના રોજ સાંજે ૫:૦૦ વાગ્યા સુધી (૩) મિલકતની તારીખ: ૨૨/૦૫/૨૦૨૬ થી ૦૬/૦૬/૨૦૨૬ ના સવારે ૧૧:૦૦ થી ૪:૦૦ વાગ્યા દરમિયાન રિઝર્વ ફંડિંગ : સ્થાવર મિલકત માટે રૂ. ૯૬,૦૦,૦૦૦/- (રૂપિયા નવપાંચ લાખ પચાસ હજાર પચાસ) (રૂપિયા નવ લાખ નેવું હજાર પુરા) બીક વૃદ્ધિ : રૂ. ૫૦,૦૦૦/- (રૂપિયા પચાસ હજાર પુરા) અને તેના ગુણાંકમાં
કુલ બાકી રકમ : રૂ. ૧,૦૭,૫૯,૨૯૭/- (રૂપિયા એક કરોડ સાત લાખ એકપચાસીઠ હજાર બરસો સપાળું પુરા) ૧૯/૦૫/૨૦૨૬ મુજબ તેમજ ૧૯/૦૫/૨૦૨૬ થી લાગુ રકત વ્યાજ અને ચાર્જિસ		

જાહેર દરાજીની શરતો અને નિયમો નીચે મુજબ છે : ૧. સિક્યોર્ડ મિલકતો રીઝર્વ ફંડિંગથી નીચે વેચવામાં આવશે નહીં. ૨. હરાજી વેચાણ ઈ-દરાજી પોર્ટલ પર માર્કેટ રગનલાઈન રહેશે. ૩. ઈ-દરાજી પોર્ટલ <https://bankauctions.in> માસફત ૦૬/૦૬/૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી પ્રેક્ટિસ પ મિનિટના અગેરે એક્સપેક્શન સાથે ચોખ્ખો. ૪. વિગતવાર મસલો અને નિયમો માટે, કંપનીની વેબસાઈટ યુઝારએલ <https://www.bajajhousingfinance.in/auction-notices> જેવા સબવા હોઈપલ સ્પષ્ટતાઓ માટે અધિકૃત અધિકારીનો સંપર્ક કરવા વિનંતી છે. તારીખ : ૨૨-૦૫-૨૦૨૬, સ્થળ : રાજકોટ

અધિકૃત અધિકારી (કુનાલ શાહ) બંજાર હાઉસિંગ ફાયનાન્સ લીમીટેડ



કેનરા બેંક Canara Bank

ભારત સરકારનું સહકર્તા

 સિન્ડિકેટ Syndicate

એઆરએમ શાખા, સાતમો માળ, ગીફ્ટ વન બિલ્ડીંગ, ગીફ્ટ સીટી, ગાંધીનગર-૩૮૨૩૫૫

જાહેર જનતા તથા દેવાદારો-જામીનદારો-ગીરવેદારોને આથી જાણ કરવાની કે નાણાંકીય મિલકતોની જામીનગીરી અને વ્યાજના પુન: લાગુ પડવા માટેનો કાયદો, ૨૦૦૨ (સરફેસી એક્ટ-૨૦૦૨) હેઠળ નિયમ ૧૩(૪) હેઠળ નીચેની મિલકતો-મિલકતોની વેચાણ અર્થે ઈ-ઓક્શન એટલે કે ઈ-દરાજી, કેનરા બેંકને લેવાના થતા લેણાની ભરપાઈ માટે સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમ ૨૦૦૨ ના નિયમ ૯ (૧) હેઠળ જયાં છે, જેમ છે, તેવી સ્થિતિમાં વેચાણ કરવાની છે એ માટે સિક્યુરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) એટલે કે જામીનગીરી વ્યાજ (લાગુ પાડેલ) ૨૦૦૨ કાયદા હેઠળ દર્શાવેલ શરતો અને નિયમો મુજબ તથા નીચેની વધારાના શરતો મુજબ વેચાણ કરવામાં આવશે.

તારીખ : ૧૧.૦૬.૨૦૨૬ ના રોજ મેગા ઈ-દરાજીની વિગતો (બપોરે ૦૧:૦૦ થી બપોરે ૦૩:૦૦ કલાક સુધી) ● ઈ.એમ.ડી.ની છેલ્લી તારીખ : ૧૦.૦૬.૨૦૨૬

ક્ર. નં.	દેવાદાર/જામીનદાર/ ગીરવેદારોના નામ	બાકી રકમ (રૂ.)	મિલકતની વિગતો / કબજાનો પ્રકાર	રીઝર્વ ફંડિંગ/ ઈએમડી (રૂ.)	ખાતાની માહિતી અને નામ, શાખાની સંપર્ક વિગતો
એઆરએમ શાખાની મિલકતો					
1	મે. પંચમુખી ઓર્થલ મીલ (માલિકી પેટી), શ્રીમતી બીના પ્રશાંત કાતરીયા (માલિક), શ્રી કલારીયા પ્રશાંત કનુભાઈ (જામીનદાર)	૩૧.૧૦.૨૦૨૫ ના રોજ OD/OCC ખાતામાં રૂ. ૧૬,૮૫,૫૧૧.૮૩ વ્યાજ અને અન્ય શુલ્ક સાથે ૦૧.૧૧.૨૦૨૫ થી અને ૧૧.૧૧.૨૦૨૫ના રોજ MSME - MFG ઉદ્યોગોને લોનમાં રૂ. ૬,૫૨,૬૬૯.૫૪ વ્યાજ અને અન્ય શુલ્ક સાથે ૧૨.૧૧.૨૦૨૫ થી એઆરએમ શાખાને જો કોઈ વસુલાત હોય તો બાદ કરીને	પ્લોટ નં. ૨૬, સિટી સર્વે નં. ઓર્ડર ૨૯૯૪/અ/૨૧ અને બેંકિંગ રેવન્યુ સર્વે નં. ૩૯૭પી૧/પી૧, ૩૯૮પી૨, ૩૯૮પી૩ પર સ્થિત પ્લોટનું ઈએમડી જેનું માપ ૧૬૬.૭૨ ચો.મી. છે, ગામ રાજુલા, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી, ગુજરાત-૩૬૪૧૪૦. ચતુર્સીમા : ઉત્તર : ખેતીલાયક જમીનનો ભાગ, દક્ષિણ : પ્લોટ નં. ૨૭. પૂર્વ : પ્લોટ નં. ૨૫, પશ્ચિમ : ૬ મીટર પહોળો રસ્તો (સિસ્કોવિટી ઇન્ટરેસ્ટ આઈડી : ૪૦૦૦૯૦૯૮૧૭૪૭) કબજાનો પ્રકાર : સાંકેતિક કબજો	રીઝર્વ ફંડિંગ : રૂ. ૪,૫૮,૦૦૦/- ઈએમડી : રૂ. ૪૫,૮૦૦/-	એઆરએમ શાખા ફોન નં. 079 - 69027812 / 818 / 823 / 820 / 822 મો. : 8238091942 / 9981840790 9680505055 ઈ-મેલ : cb3966@canarabank.com A/C No.: 209272434 IFSC : CNRB0003966
2	મે. સુપરગેસ મિનરલ એલએલપી (મશાઈત જવાબદારી ભાગીદારી પેટી), શ્રી અલ્વેશ પ્રભુલાલ ભાલોડિયા (નિયુક્ત ભાગીદાર), શ્રી હિંસુ ભાવિન કાંતિલાલ (નિયુક્ત ભાગીદાર), શ્રી દલસાણીયા હિતેશ રણછોડભાઈ (નિયુક્ત ભાગીદાર), શ્રી આશિષ આર ભંસદકિયા (ભાગીદાર), શ્રી શાહ નિપુલભાઈ ભગવાનજીભાઈ (જામીનદાર)શ્રી ભીમાણી મનીષભાઈ રણછોડભાઈ (ભાગીદાર) અને શ્રી રાજેન્દ્રભાઈ ભ ગ વ ન જી ભા િ ડ ગા મી (ભાગીદાર)	રૂ. ૪,૦૪,૬૧,૨૬૩.૭૬ તા. ૨૨.૦૧.૨૦૨૬ મુજબ વત્તા આગામી વ્યાજ અને ચાર્જિસ	પ્લોટ નં. ૨૭, સિટી સર્વે નં.ઓર્ડર ૨૯૯૪/અ/૨૨ અને બેંકિંગ રેવન્યુ સર્વે નં. ૩૯૭પી૧/પી૧, ૩૯૮પી૨, ૩૯૮પી૩ પર સ્થિત પ્લોટનું ઈએમડી જેનું માપ ૧૬૫.૦૦ ચો.મી. છે, ગામ રાજુલા, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી, ગુજરાત-૩૬૪૧૪૦. ચતુર્સીમા : ઉત્તર : પ્લોટ નં. ૨૬, દક્ષિણ : પ્લોટ નં. ૨૮. પૂર્વ : પ્લોટ નં. ૨૪, પશ્ચિમ : ૬ મીટર પહોળો રસ્તો (સિસ્કોવિટી ઇન્ટરેસ્ટ આઈડી : ૪૦૦૦૯૦૯૮૧૭૪૭) પ્લોટ નં. ૨૮ સિટી સર્વે નં.ઓર્ડર ૨૯૯૪/અ/૨૩ અને બેંકિંગ રેવન્યુ સર્વે નં. ૩૯૭પી૧/પી૧, ૩૯૮પી૨, ૩૯૮પી૩ પર સ્થિત પ્લોટનું ઈએમડી જેનું માપ ૧૬૫.૦૦ચો.મી. છે, ગામ રાજુલા, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી, ગુજરાત-૩૬૪૧૪૦ ચતુર્સીમા : ઉત્તર : પ્લોટ નં. ૨૭, દક્ષિણ : પ્લોટ નં. ૨૬. પૂર્વ : પ્લોટ નં. ૨૩, પશ્ચિમ : ૬ મીટર પહોળો રસ્તો (સિસ્કોવિટી ઇન્ટરેસ્ટ આઈડી : ૪૦૦૦૯૦૯૮૧૭૪૭) કબજાનો પ્રકાર : સાંકેતિક કબજો	રીઝર્વ ફંડિંગ : રૂ. ૯,૫૦,૦૦૦/- ઈએમડી : રૂ. ૯૦,૭૦૦/-	
3	મે. સુપરગેસ મિનરલ એલએલપી (મશાઈત જવાબદારી ભાગીદારી પેટી), શ્રી અલ્વેશ પ્રભુલાલ ભાલોડિયા (નિયુક્ત ભાગીદાર), શ્રી હિંસુ ભાવિન કાંતિલાલ (નિયુક્ત ભાગીદાર), શ્રી દલસાણીયા હિતેશ રણછોડભાઈ (નિયુક્ત ભાગીદાર), શ્રી આશિષ આર ભંસદકિયા (ભાગીદાર), શ્રી શાહ નિપુલભાઈ ભગવાનજીભાઈ (જામીનદાર)શ્રી ભીમાણી મનીષભાઈ રણછોડભાઈ (ભાગીદાર) અને શ્રી રાજેન્દ્રભાઈ ભ ગ વ ન જી ભા િ ડ ગા મી (ભાગીદાર)	રૂ. ૪,૦૪,૬૧,૨૬૩.૭૬ તા. ૨૨.૦૧.૨૦૨૬ મુજબ વત્તા આગામી વ્યાજ અને ચાર્જિસ	ઈએમડી ફેક્ટરી જમીન અને બિલ્ડિંગનો રેવન્યુ સર્વે નં. ૫૦૬/પી૧/પી૩, જે મોજે ગામ જયસતમગઢ, તાલુકો/જીલ્લો મોરબી, ગુજરાત ખાતે છે. જેનું ક્ષેત્રફળ ૮૦૯૪.૧૦૦ ચો.મી. છે. જેની ચતુર્સીમા નીચે મુજબ છે. ઉત્તર : મે. મોન્ટાના ટાઈલ્સ પ્રાઈવેટ લિમીટેડ, દક્ષિણ : સોલેરીયા સીરામિક પ્રા.લિ., પૂર્વ : ખેત તલાવનું, પશ્ચિમ : મોરબી-જેતલપર રોડ કબજાનો પ્રકાર : સાંકેતિક કબજો	રીઝર્વ ફંડિંગ : રૂ. ૨,૧૨,૪૦,૦૦૦/- ઈએમડી : રૂ. ૨૧,૨૪,૦૦૦/-	
4	મે. સુપરગેસ ટાઇલ્સ એલએલપી (મશાઈત જવાબદારી ભાગીદારી), શ્રી અલ્વેશ પ્રભુલાલ ભાલોડિયા (નિયુક્ત ભાગીદાર), શ્રી હિંસુ ભાવિન કાંતિલાલ (નિયુક્ત ભાગીદાર), શ્રી દલસાણીયા હિતેશ રણછોડભાઈ (નિયુક્ત ભાગીદાર), શ્રી આશિષ આર ભંસદકિયા (ભાગીદાર), શ્રી યશ રાજેન્દ્રભાઈ ભીમાણી (ભાગીદાર), શ્રી શાહ નિપુલભાઈ ભગવાનજીભાઈ (ભાગીદાર), શ્રી રંજય રૂઝાણા ભાઈ પનારા (ભાગીદાર) અને શ્રી જયદિપ કુમાર વેલગુભાઈ ઉદેશજી (ભાગીદાર)	રૂ. ૭,૯૪,૨૯,૮૬૮.૪૬ તા. ૨૨.૦૧.૨૦૨૬ મુજબ વત્તા આગામી વ્યાજ અને ચાર્જિસ	ઈએમડી ફેક્ટરી જમીન અને બિલ્ડિંગના તમામ પીસ સર્વે નં. ૨૬૯/પી૩/પી૨, જે મોજે ગામ રંગપર, તાલુકો/જીલ્લો મોરબી, ગુજરાત ખાતે છે. જેનું ક્ષેત્રફળ ૧૬૭૯૪.૦૦ ચો.મી. છે. જેની ચતુર્સીમા નીચે મુજબ છે. ઉત્તર : એસ. નં. ૨૭૪ અને ૨૭૫ની કૃષિ જમીન, દક્ષિણ : એસ. નં. ૨૬૯પીની કૃષિ જમીન, પૂર્વ : એસ. નં. ૨૭૦ની કૃષિ જમીન, પશ્ચિમ : એસ. નં. ૨૬૯પીની જમીનના માલિક લોકેશ સીરામીક એસેટ્સ આઈડી : ૨૦૦૦૫૮૫૮૪૮૯૧ કબજાનો પ્રકાર : સાંકેતિક કબજો	રીઝર્વ ફંડિંગ : રૂ. ૫,૧૫,૦૦,૦૦૦/- ઈએમડી : રૂ. ૧૧,૫૦,૦૦૦/-	
5	શ્રી રાધે મિનરલ (માલિકીની પેટી) શ્રી રતનશી બેશરા સ્વારીયા (માલિક) શ્રી બેશરા નારસંકાર સ્વારીયાના પુત્ર એવિસ. શ્રી રતનશી પટેલ	તા. ૧૭.૧૦.૨૦૨૫ ના રોજ રૂ. ૭૭,૨૨,૩૪૬.૦૦ MSME-OD/OCC ખાતામાં અને તા. ૧૮.૧૦.૨૦૨૫ થી વ્યાજ અને અન્ય ખર્ચ સાથે અને તા. ૩૦.૦૯.૨૦૨૪ ના રોજ રૂ. ૬૬,૧૨,૭૫૪.૭૦ MSME - MFG ફેક્ટરીજી ખાતામાં અને તા. ૦૧.૧૦.૨૦૨૫ થી વ્યાજ અને અન્ય ચાર્જિસ સાથે	ઈએમડી ફેક્ટરી જમીન અને બિલ્ડિંગના તમામ પીસ અને પાસલ જેનો રેવન્યુ સર્વે નં. ૧૨૨/૨/પી૧, ખાતા નં. ૨૪૬ જે મોજે હાનેટી સીમ ભૂપ તાલુકો અને જીલ્લો કચ્છ છે. જેનું ક્ષેત્રફળ ૯૨૦૭.૦૦ ચો.મી. છે. જેની ચતુર્સીમા નીચે મુજબ છે. ઉત્તર : આર.એસ. નં. ૧૨૨/૧, દક્ષિણ : રોડ, પૂર્વ : આર.એસ. નં. ૧૨૬, પશ્ચિમ : આર.એસ. નં. ૧૨૨/૧ કબજાનો પ્રકાર : સાંકેતિક કબજો	રીઝર્વ ફંડિંગ : રૂ. ૧,૧૩,૪૦,૦૦૦/- ઈએમડી : રૂ. ૧૧,૩૪,૦૦૦/-	
6	શ્રી નિશિત જયકાંત બગાડિયા (દેવાદાર અને ગીરવેદાર)	તા. ૦૬.૦૫.૨૦૨૫ ના રોજ રૂ. ૧,૦૮,૬૨,૬૮૭.૩૩ વત્તા આગામી વ્યાજ અને ચાર્જિસ તા. ૦૭.૦૫.૨૦૨૫ થી	સ્થાવર મિલકતનો તમામ ભાગ અને ભાગ ખુલ્લો પ્લોટ/બંગલો નં. ૧૧૩ છે જેનો કુલ વિસ્તાર ૩૨૫.૭૨ ચોરસ મીટર અને પ્લોટ/બંગલો નં. ૧૨૬ છે જેનો કુલ વિસ્તાર ૨૦૨.૭૨ ચોરસ મીટર છે. કુલ પ્લોટ વિસ્તાર ૫૨૭.૪૪ ચોરસ મીટર છે, જેમાં બ્લોક/ આર.એસ. પર સ્થિત ‘ગંગાનલ’ તરીકે ઓળખાતી ચોળનામાં કોમલ રોડ અને કોમલ પ્લોટ અને તેના પર બાંધકામનો અવિભાજિત પ્રો-રેટ હિસ્સો છે. નં. ૮૭૨ (જૂની આરએસ નં. ૫૮૭/૩/એ/પેકી ૨), બ્લોક/આરએસ નં. ૮૭૩ (જૂનો આરએસ નં. ૫૮૭/૩/એ/પેકી ૨ પેકી ૫), બ્લોક/આર એસ નં.૮૭૪ (જૂનો આરએસ નં. ૫૮૭/૩/એ પેકી ૨ પેકી નં. ૫૮૭/૩/એ પેકી ૨ પેકી ૪) રજુરેશન જીલ્લા વડોદરા તાલુકા અધિકારિયા, ગુજરાતના મોજે કુનેયા ગામ. પ્લોટ ૧૧૩ ની ચતુ:સીમા : પૂર્વ : ૦.૫૦ મીટર પહોળો રસ્તો, પશ્ચિમ : પ્લોટ નં. ૧૨૬, ઉત્તર : પ્લોટ નં. ૧૧૪, દક્ષિણ : બ્લોક નં. ૮૫૫. પ્લોટ નં. ૧૨૬ માટે : પૂર્વ : પ્લોટ નં. ૧૧૩, પશ્ચિમ : ૦.૫૦ મીટર પહોળો રસ્તો, ઉત્તર : પ્લોટ નં. ૧૨૨, દક્ષિણ : બ્લોક નં. ૮૫૫ (સિસ્કોવિટી ઇન્ટરેસ્ટ આઈડી : ૪૦૦૦૫૦૯૨૨૨૮) કબજાનો પ્રકાર : સાંકેતિક કબજો	રીઝર્વ ફંડિંગ : રૂ. ૨૬,૧૨,૦૦૦/- ઈએમડી : રૂ. ૪,૬૫,૦૦૦/-	

ક્ર. નં.	દેવાદાર/જામીનદાર/ ગીરવેદારોના નામ	બાકી રકમ (રૂ.)	મિલકતની વિગતો / કબજાનો પ્રકાર	રીઝર્વ ફંડિંગ/ ઈએમડી (રૂ.)	ખાતાની માહિતી અને નામ, શાખાની સંપર્ક વિગતો
એઆરએમ શાખાની મિલકતો					
7	મેસર્સ ઉમા ભવાની ઓર્થલ ઈન્ડસ્ટ્રીઝ (ભાગીદારી પેટી) દેવાદાર શ્રી મિલિનાભાઈ પ્રવિણભાઈ પટેલ (ભાગીદાર અને જામીનદાર) શ્રી નાગરભાઈ મોહનભાઈ પંચાલા (ભાગીદાર અને જામીનદાર), શ્રીમતી વર્ષાબેન રતનાસિંહ ડોડીયા (ભાગીદાર અને જામીનદાર), શ્રીમતી નિમુબેન ચંદ્રકાન્તભાઈ વિઠ્ઠલપરા (ભાગીદાર અને જામીનદાર), શ્રી જીતેન્દ્રકુમાર ખાતામાં કેનેરા બેંક એસેટ રિકર્ડર મેનેજમેન્ટ શાખા,અમદાવાદ	રૂ. ૩,૦૯,૫૬,૨૮૯.૬૨ વત્તા વધારાના વ્યાજ અને અન્ય ચાર્જ સીસી લિમિટ ખાતામાં અને ૧૪.૦૩.૨૦૨૫ ના રોજ રૂ. ૩,૧૭,૧૩,૩૭૩.૭૧ વત્તા વધારાના વ્યાજ અને અન્ય ચાર્જ ટર્મ લોન ખાતામાં	સ્થાવર મિલકતના તમામ પીસ અને પાસલ જે મોજે રતનપર, તાલુકો ધાંગધા, સળ ડિસ્ટ્રીક્ટ ધાંગધા, જીલ્લો સુરેન્દ્રનગર ખાતે આવેલ છે, જેનો રેવન્યુ સર્વે નં. ૧૬૫, ક્ષેત્રફળ ૧૧૪૮૬ ચો.મી. પેકી ૪૨૭૨ ચો.મી. (રેવન્યુ રેકોર્ડ પ્રમાણે સર્વે નં. ૧૬૫/પેકી/૧) કુલ ૮૩૦૬ ચો.મી. એન.એ. જમીન ઈન્ડસ્ટ્રીયલ માટે મે. ઉમા ભવાની ઈન્ડસ્ટ્રીઝના કબજામાં ભાગીદારી પેટી. જેની મિલકત (ડિડ મુજબ) ચતુ:સીમા : પૂર્વ : ખેતીલાયક જમીનનો સર્વે નં. ૧૬૫ પેકી ભાગ અને સર્વે નં. ૧૬૬ પેકી, પશ્ચિમ : સરકારી ખરાળો, ઉત્તર : ખેતીલાયક જમીનનો સર્વે નં. ૧૬૪, દક્ષિણ : સર્વે નં. ૧૬૯ (સરકારી ખરાળોની જમીન) અને ખેતીલાયક જમીનનો સર્વે નં. ૧૬૭ કબજાનો પ્રકાર : પ્રત્યક્ષ કબજો	રીઝર્વ ફંડિંગ : રૂ. ૧,૦૦,૦૦,૦૦૦/- ઈએમડી : રૂ. ૧૦,૦૦,૦૦૦/-	
8	દેવજીભાઈ દશલાણીયા (જામીનદાર) શ્રી પ્રવિણભાઈ કરાનાભાઈ પાંચાલા (જામીનદાર)	રૂ. ૩૦,૧૭,૧૧૬.૬૬ તા. ૩૦.૦૯.૨૦૨૫ મુજબ વત્તા અગાઉનું વ્યાજ અને ચાર્જિસ વગેરે	તામાન હિસ્સો અને પાસલ ધારવાલી સ્થાવર મિલકત, જે બિન-ખેતી પ્લોટ નં. ૪, ક્ષેત્રફળ ૧૮૩.૮૯ ચો.મી. ધરાયે છે, તેની પર ઘર બાંધવાના અધિકાર સાથે, જેનું કુલ ક્ષેત્રફળ ૨૨૭.૫૧ ચો.મી. થાય છે. આ મિલકત તેની સાથે જોડાયેલા તમામ હકો અને સંલગ્ન સુવિધાઓ સાથે, નવા સીટી સર્વે નં. ૧૦૧૩/૪ વાળી જમીન પર આવેલી છે, જે ગામ : રોલા, તાલુકો : વલસાડ, જિલ્લો : વલસાડ ખાતે સ્થિત છે. ચતુ:સીમા : ઉત્તર : જોડાયેલ જમીન, દક્ષિણ : જોડાયેલ જમીન, પૂર્વ : જોડાયેલ જમીન, પશ્ચિમ : પ્રવેશ દ્વાર અને રસ્તો (સિસ્કોવિટી ઈન્ટરેસ્ટ આઈડી : ૪૦૦૦૬૯૭૫૦૩૩) કબજાનો પ્રકાર : પ્રત્યક્ષ કબજો	રીઝર્વ ફંડિંગ : રૂ. ૧,૧૦,૦૦,૦૦૦/- ઈએમડી : રૂ. ૧,૮૩,૮૦૦/-	
9	શ્રી શિવસાગર રામાધર દુલે (દેવાદાર અને ગીરવેદાર)	રૂ. ૩૦,૧૭,૧૧૬.૬૬ તા. ૩૦.૦૯.૨૦૨૫ મુજબ વત્તા અગાઉનું વ્યાજ અને ચાર્જિસ વગેરે	તામાન હિસ્સો અને પાસલ ધારવાલી સ્થાવર મિલકત, જે બિન-ખેતી પ્લોટ નં. ૪, ક્ષેત્રફળ ૧૮૩.૮૯ ચો.મી. ધરાયે છે, તેની પર ઘર બાંધવાના અધિકાર સાથે, જેનું કુલ ક્ષેત્રફળ ૨૨૭.૫૧ ચો.મી. થાય છે. આ મિલકત તેની સાથે જોડાયેલા તમામ હકો અને સંલગ્ન સુવિધાઓ સાથે, નવા સીટી સર્વે નં. ૧૦૧૩/૪ વાળી જમીન પર આવેલી છે, જે ગામ : રોલા, તાલુકો : વલસાડ, જિલ્લો : વલસાડ ખાતે સ્થિત છે. ચતુ:સીમા : ઉત્તર : જોડાયેલ જમીન, દક્ષિણ : જોડાયેલ જમીન, પૂર્વ : જોડાયેલ જમીન, પશ્ચિમ : પ્રવેશ દ્વાર અને રસ્તો (સિસ્કોવિટી ઈન્ટરેસ્ટ આઈડી : ૪૦૦૦૬૯૭૫૦૩૩) કબજાનો પ્રકાર : પ્રત્યક્ષ કબજો	રીઝર્વ ફંડિંગ : રૂ. ૧,૧૦,૦૦,૦૦૦/- ઈએમડી : રૂ. ૧,૮૩,૮૦૦/-	
10	મે. રાગુના એન્ટરપ્રાઈઝ (દેવાદાર), શ્રી વસંતભાઈ ગોરીશંકર મહેતા (પ્રોપરાઈટર /ગીરવેદાર) અને શ્રી કિશ્વકાંત ગોરીશંકર મહેતા (જામીનદાર)	રૂ. ૪,૫૫,૪૯,૨૪૧.૬૪ તા. ૧૬.૦૬.૨૦૨૫ મુજબ વત્તા અગાઉનું વ્યાજ અને ચાર્જિસ વગેરે	જમીન અને બિલ્ડિંગના સ્થાવર મિલકતના તમામ પીસ અને પાસલ (એનએ જમીન)નો સમાન ગીરો જે મોજે : આઈદેની જમીનનો ટી.પી. સ્કીમ નં. ૩, એફ.પી. નં. ૪૯૭ પેકી સળ પ્લોટ નં. ૨, કુલ ક્ષેત્રફળ ૩૯૩.૫૦ ચો.મી., સી.એસ. નં. ૬૨૧, વોર્ડ નં. આઈદે-૧, શીટ નં. ટી-૩/શીટ નં. ૨૫, સિટી સર્વેનું ક્ષેત્રફળ ૩૯૨.૫૦ ચો.મી. બાંધકામ એરોસાનું ક્ષેત્રફળ ૨૦૮.૬૫ ચો.મી. મ્યુનિસિપલ મિલકત નં. ૧૨/૩૧/૧૦૮/૧, સુપરટેન્ડેન્સ સળ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીક્ટ આઈદે અને ચતુસીમા નીચે મુજબ છે. ઉત્તર : ૪૦.૦૦ ફૂટ ટી.પી. રોડ, દક્ષિણ : સળ પ્લોટ નં. ૧, પૂર્વ : ૪૦.૦૦ ફૂટ ટી.પી. રોડ, પશ્ચિમ : સળ પ્લોટ નં. ૩ (સરસઈ સિસ્કોરીટી ઈન્ટરેસ્ટ આઈડી : ૪૦૦૦૭૯૪૩૨૩૩) કબજાનો પ્રકાર : પ્રત્યક્ષ કબજો	રીઝર્વ ફંડિંગ : રૂ. ૨,૦૫,૦૦,૦૦૦/- ઈએમડી : રૂ. ૨૦,૫૦,૦૦૦/-	એઆરએમ શાખા ફોન નં. 079 - 69027812 / 818 / 823 / 820 / 822 મો. : 8238091942 / 9981840790 9680505055 ઈ-મેલ : cb3966@canarabank.com A/C No.: 209272434 IFSC : CNRB0003966
11	મે. આરશા સિરામિકા (ભાગીદારી પેટી) તેના ભાગીદારો દ્વારા રજૂ કરવામાં આવી હતી - શ્રી હાર્દિક મગનભાઈ છગોલા (પાર્ટનર), શ્રી પીયૂષ જગદીશભાઈ ચડાણીયા (ભાગીદાર), શ્રી પ્રદિપ મણીભાઈ કાલરીયા (ભાગીદાર) અને શ્રીમતી રમાબેન અરવિંદભાઈ ખોખાણી (ભાગીદાર) અને તેના જામીનદાર શ્રી મગનભાઈ અમરશાભાઈ છગોલા (જામીનદાર), શ્રી જગદીશભાઈ વેલજીભાઈ ચડાણીયા (જામીનદાર), શ્રી મણીલાલ કરશનભાઈ કાલરીયા (જામીનદાર) અને શ્રી અરવિંદ મગનલાલ ખોખાણી (જામીનદાર) દ્વારા પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું.	તા. ૦૨.૦૧.૨૦૨૬ ના રોજ MSME-OD/OCC ખાતામાં વ્યાજ અને અન્ય શુલ્ક સાથે રૂ. ૪,૨૭,૩૭,૮૭૨.૧૭ અને ૦૨.૦૧.૨૦૨૬ ના રોજ MSME - Mfg ઈન્ડસ્ટ્રીઝને લોન ખાતામાં વ્યાજ અને અન્ય શુલ્ક સાથે રૂ. ૭,૭૩,૨૨,૬૨૭.૪૫, કેનેરા બેંકની એઆરએમ શાખા, અમદાવાદને ચૂકવવાના બાકી છે.	જમીન અને બિલ્ડિંગના તમામ પીસ અને પાસલનો સમાનગીરો જે સર્વે નં. ૧૪૫૫૫ પેકી જમીન, લાલપર, તાલુકો મોરળી, જી. મોરળી, ગુજરાત ખાતે બાંધવામાં આવેલ છે. જેનું ચંદાણત ક્ષેત્રફળ ૧૧,૪૩૩ ચો.મી. ચતુ:સીમા : ઉત્તર : એસ. નં. ૧૪૪ અને જમ્પની ની જમીન અને તે પછી વેસ્ટ જમીન, દક્ષિણ : એસ. નં. ૧૪૬ અને તે પછી વેસ્ટ જમીન, પૂર્વ : ગડામાર્ગ અને વેસ્ટ જમીન, પશ્ચિમ : એસ. નં. ૧૪૪ અને તે પછી નેશનલ હાઈવે CERSAID ASSET ID : 200087806391 કબજાનો પ્રકાર : સાંકેતિક કબજો	રીઝર્વ ફંડિંગ : રૂ. ૧,૫૦,૦૦,૦૦૦/- ઈએમડી : રૂ. ૫૫,૦૦,૦૦૦/-	
12	મેહુલભાઈ વસંતભાઈ બારોટ (દેવાદાર / ગીરવેદાર), સેવજીભાઈ મેહુલકુમાર બારોટ (દેવાદાર / ગીરવેદાર)	રૂ. ૩૦,૪૦,૬૭૧.૨૬ તા. ૨૯.૧૨.૨૦૨૫ શ્રી લાગુ તેની પરના વ્યાજ અને ચાર્જિસ બાદ વસુલાત બે હોય તો	રહેણાંક પ્લોટના તમામ પીસ અને પાસલ જેનો રેવન્યુ સર્વે નં. ૪૯૧ બ્યુ (જુનો સર્વે નં. ૩૮૧) પેકી “ડીફ” ટાઈપ પ્લોટ ડીફ-૧૯ (મંજૂર પ્લાન મુજબ “ગાર્ડન સીટી” પ્લોટ નં. ડી-૧૫૩) ચંદાણત ૭૯૭.૮૨ ચો.ફીટ એટલે કે ૭૪.૧૨ ચો.મી. બિલ્ડ અપ એરીયા ૯૪૭.૭૬ ચો.ફીટ, જીરાલી, અંકલેશ્વર, ભરૂચ ખાતે સ્થિત છે. ચતુ:સીમા : (સાઈટ પ્લાન મુજબ) : ઉત્તર : પ્લોટ નં. ડીફ-૧૮, દક્ષિણ : પ્લોટ નં. ડીફ-૨૦, પૂર્વ : પ્લોટ નં. ડીફ-૪૮, પશ્ચિમ : સોસાયટી રોડ, ચતુ:સીમા : (મંજૂર પ્લાન મુજબ) : ઉત્તર : પ્લોટ નં. ડી-૧૫૪, દક્ષિણ : પ્લોટ નં. ડી-૧૫૨, પૂર્વ : પ્લોટ નં. ડી-૧૬૨, પશ્ચિમ : સોસાયટી રોડ કબજાનો પ્રકાર : સાંકેતિક કબજો	રીઝર્વ ફંડિંગ : રૂ. ૩૩,૫૦,૦૦૦/- ઈએમડી : રૂ. ૩,૩૫,૦૦૦/-	